

ARDI INVESTMENT AND TRADING CO LTD

Registered office: Shop No. 3 Hemu Castle, Dadabhai Road,
Near Gokhlibai School Vile Parle (W) Mumbai-400056, Maharashtra

CIN: L65923MH1981PLC024912

Website: www.ardi.co.in Ph.: 022-28764128 Email id: complianceardi@gmail.com

Date: 04/11/2023

To,
BSE Limited
P. J. Towers,
Dalal Street,
Mumbai-400001.
Scrip Code: 504370

Dear Sir/Madam,

Subject: Intimation of Newspaper Publication

As per the Captioned Subject, We hereby intimate you that the Company has published its Financial Result for the Quarter ended as on 30.09.2023 in Business Standard English language Newspaper and Jai Hind Ahmedabad Local language Newspaper published as on 04.11.2023.

Further, the copy of both the newspaper is attached herewith for your kind reference.

You are requested to take the same on records.

Thanking you,

For, Ardi Investment and Trading Co. Ltd

Gautam
Pravinchandra Sheth
a Sheth

Digitally signed by
Gautam
Pravinchandra Sheth
Date: 2023.11.04
12:28:30 +05'30'

Gautam Pravinchandra Sheth
Managing Director
(DIN: 06748854)

DEUTSCHE BANK AG

637 GULBAI TEKRA, GROUND FLOOR, OPP CII HOUSE, AHMEDABAD-380006

PUBLIC NOTICE FOR E-AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES

LAST DATE TIME OF SUBMISSION OF EMD AND DOCUMENTS 20th November 2023 upto 3:00 pm

Sale of immovable property mortgaged to Bank under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (SARFAESI) Act, 2002 (No.54 of 2002)

Whereas, the Authorized Officer of DEUTSCHE BANK AG had taken possession of the following property/ies pursuant to the notice issued under Sec 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (SARFAESI) Act, 2002 in the following loan accounts with our Branch with a right to sell the same on "AS IS WHERE IS BASIS AND AS IS WHAT IS BASIS" for realization of Bank's dues. The sale will be done by the undersigned through e-auction platform provided at the website: <https://www.bankauctions.com>

DESCRIPTION OF IMMOVABLE PROPERTIES

Lot No	Name of the Branch & Account	Property Description	Demand Notice Date	Authorized Officer's Details	EMD SUBMISSION DETAILS	Reserve Price		Date/ Time of e-Auction
						Outstanding Amount (Secured debt)	EMD Minimum Bid	
1	Deutsche Bank AG, 637 GULBAI TEKRA, GROUND FLOOR, OPP CII HOUSE, AHMEDABAD-380006 1. MS SPS TUBES INDUSTRIES 2. Mr. SUNNY PRAKASHRAJ JAIN 3. Mrs. SAROJ PRAKASHRAJ JAIN 4. Mr. PRAKASHRAJ SESMALJI JAIN	Plot/Bungalow No. 12/B, "Amatvilla" measuring 1177 sq.yards i.e. 984.12 sq.mtrs. and construction thereon with 4 BHK with sitting area, 4 car parking as a member of "Shantiniketan Cooperative Housing Society Ltd." Situated at Final Plot No. 817 of TPS 3(Survey No.29) NEAR GUJARAT COLLEGE ELLISBRIDGE, AHMEDABAD-380006	18.01.2022 Rs.15,02,30,093.12/- (Rupees Fifteen Crores Two Lakhs Thirty Thousand Ninety Three and Paise Twelve Only) as on 08.01.2022 + interest + other charges	Mr. Saurabh Shah, Mobile No. 9712995845 Email id : saurabh.a.shah@db.com	A/c No. 078494027010068 A/c Name - Deutsche Bank AG EMD - Name of the Beneficiary - Deutsche Bank AG IFSC- DEUT0784PBC	8,00,00,000 80,00,000 (10% of The Reserve Price) 1,00,00,000 (Bid Inc. Amount)	21.11.2023, 12:00 PM	

The e-Auction is being held on "AS IS WHERE IS" and "AS IS WHAT IS BASIS".

- To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance on any property. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property/ies put on auction and claims/ rights/ dues/ effecting the property, prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorized Officer/ Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues.
- It shall be the responsibility of the bidders to inspect and satisfy themselves about the asset and specification before submitting the bid. The inspection of property/ies put on auction will be permitted to interested bidders on 10.11.2023 between 11 am to 3 pm.
- The interested bidders shall submit their EMD through Web Portal: <https://www.bankauctions.com> (the user ID & Password can be obtained free of cost by registering name with <https://www.bankauctions.com>) through Login ID & Password. The EMD shall be payable through NEFT in the account mentioned above. After Registration (One Time) by the bidder in the Web Portal, the intending bidder/ purchaser is required to get the copies of the following documents uploaded in the Web Portal before the Last Date & Time of submission of the Bid Documents viz: i) Copy of the NEFT/RTGS Challan or Demand Draft; ii) Copy of PAN Card; iii) Proof of Identification/ Address Proof (KYC) viz. self-attested copy of Voter ID Card/ Driving License/ Passport etc.; without which the Bid is liable to be rejected. UPLADING SCANNED COPY OF ANNEXURE-II & III (can be downloaded from the Web Portal: <https://www.bankauctions.com>) AFTER DULY FILLED UP & SIGNING IS ALSO REQUIRED. The interested bidders who require assistance in creating Login ID & Password, uploading data, submitting Bid Documents, Training/ Demonstration on Online Inter-se Bidding etc., may contact M/s. C1 India Pvt.Ltd, Udyog Vihar, Phase 2, Gulf Petrochem building, Building No. 301, Gurgaon, Haryana. Email ID: support@bankauctions.com, Support/HelpLine Numbers: 124-430202/21/22/23, 7291981124/ 1125/ 1126, Sales Enquiries : sales@bankauctions.com, 7291981129 and for any property related query may contact Authorised Officer: Mr. Saurabh Shah; Mobile No.9712995845 e-mail ID: saurabh.a.shah@db.com during the working hours from Monday to Saturday.
- The interested bidder has to submit their Bid Documents (not below the Reserve Price) and required documents (mentioned in Point No. 3) on/ before 20.11.2023 upto 3:00 pm and after going through the Registering Process (One time) and generating User ID & Password of their own, shall be eligible for participating in the e-Auction Process, subject to due verification (of the documents) and/ or approval of the Authorized Officer. EMD also can be deposited in the bank by way demand draft favoring "Deutsche Bank AG EMD" the same will be returned to unsuccessful bidder.
- During the Online Inter-se Bidding, Bidder can improve their Bid Amount as per the Bid Enhancement Amount (mentioned above) or its multiple and in case bid is placed during the last 5 minutes of the closing time of the e-Auction, the closing time will automatically get extended for 5 minutes (each time till the closure of e-Auction process), otherwise, it'll automatically get closed. The bidder who submits the highest bid amount (not below the Reserve Price) on the closure of the e-Auction Process shall be declared as a Successful Bidder by the Authorized Officer/ Secured Creditor, after required verification.
- The Earnest Money Deposit (EMD) of the successful bidder shall be retained towards part sale consideration and the EMD of unsuccessful bidders shall be refunded. The Earnest Money Deposit shall not bear any interest. The successful bidder shall have to deposit 25% of the sale price, adjusting the EMD already paid, within 24 hours of the acceptance of bid price by the Authorized Officer and the balance 75% of the sale price on or before 15th day of sale or within such extended period as agreed upon in writing by and solely at the discretion of the Authorized Officer. In case of default in payment by the successful bidder, the amount already deposited by the offer shall be liable to be forfeited and property shall be put to re-auction and the defaulting borrower shall have no claim/ right in respect of property amount.
- The prospective qualified bidders may avail online training on e-Auction from M/s. C1 India Pvt. Ltd. prior to the date of e-Auction. Neither the Authorized Officer/ Bank nor M/s. C1 India Pvt. Ltd. shall be liable for any Internet Network problem and the interested bidders to ensure that they are technically well equipped for participating in the e-Auction event.
- The purchaser shall bear the applicable stamp duties/ additional stamp duty/ transfer charges, fee etc. and also all the statutory/ non-statutory dues, taxes, rates, assessment/ electricity charges, fees etc. owing to anybody.
- The Authorized Officer is not bound to accept the highest offer and the Authorized Officer has the absolute right to accept or reject any or all offer(s) or adjourn/ postpone/ cancel the e-Auction without assigning any reason thereof.
- The bidders are advised to go through the detailed Terms & Conditions of e-Auction available on the Web Portal of M/s. C1 India Pvt. Ltd., <https://www.bankauctions.com> before submitting their bids and taking part in the e-Auction.
- The publication is subject to the force major clause.
- Please treat this as notice under Rule 8(6) and Rule 9(1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Special Instructions

- Bidding in the last moment should be avoided in the bidders own interest as neither the DEUTSCHE BANK AG nor Service provider will be responsible for any lapse/failure (Internet failure/power failure etc.) in order to ward-off such contingent situations bidders are requested to make all necessary arrangements / alternatives such as power supply back-up etc, so that they are able to circumvent such situation and are able to participate in the auction successfully.

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002

The borrower/ guarantors are hereby notified to pay the sum as mentioned above along with upto date interest and ancillary expenses before the date of e-Auction, failing which the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with interest and cost.

**Authorised Officer
DEUTSCHE BANK AG**

Government of India, Ministry of Finance

DEBTS RECOVERY TRIBUNAL-II

3rd Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad, Gujarat.

FORM NO. 22 (Earlier DE) [Regulation 36 & 37 of DRT Regulations, 2015] [See Rule 52 (1) (2) of the Second Schedule to the Income Tax Act, 1961]
READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993

E-AUCTION / SALE NOTICE

THROUGH REGD. AD / DASTI/ AFFIXATION / BEAT OF DRUM / PUBLICATION

RP / RC No. 309/2021 O.A. No. 555/2020

Certificate Holder Bank : HDFC Bank Ltd. Vs. Certificate Debtors : Gautam Textiles & Ors.

To, C.D. No. 1 : Gautam Textiles, A Proprietorship Firm Represented by and through its proprietor Mr. Vijay Sopanrao Awate, and having its principal place of business at Shop No. D-333, Udhna Uddiyoggar Sahkari Sangh, Udhna Station Road, Nr. Divyabaskar Office, Udhna, Surat.
C.D. No. 2 : Mr. Vijay Sopanrao Awate, Ault, Occupation : Business, Flat No. 208, Roshni Apartment, Palanpur Patiya, Adajan road, Surat-395005
C.D. No. 3 : Sonal Vijay Awate, Ault, Occupation : Business, Flat No. 208, Roshni Apartment, Palanpur Patiya, Adajan road, Surat-395005
And also at : Flat No. F/302, Pavitra Residency, Rander Road, Surat
And also at : Flat No. F/302, Pavitra Residency, Rander Road, Surat

The aforesaid CDs No. 1 - 3 have failed to pay the outstanding dues of **Rs. 32,59,942.00 (Rupees Thirty Two Lakhs Fifty Nine Thousand Nine Hundred Forty Two Only)** as on 29.08.2020 including interest in terms of judgement and decree dated 25.08.2021 passed in O.A. No. 555/2020 as per my order dated 19.10.2023 under mentioned property (s) will be sold by public e-auction in the aforementioned matter. The auction sale will be held through "online e-auction" Website: <https://www.bankauctions.com>.

Lot	Description of the property	Reserve Price (Rounded off)	EMD 10% or (Rounded off)
1.	All that piece and parcel of the immovable property bearing Flat No. 302, third Floor, Building F-1, Pavitra Residency, Beside Ambika Nagar, Opp. Bhagyalaxmi Society, Palanpur Ugat Road, Jahangirabad, Taluka Choryasi, Dist. Surat- 395 005.	Rs. 16.35 Lakh	Rs. 1.70 Lakh
2.	Flat No. C/10, Ground Floor, Building - C, Samrat Sagar Apartment, Beside Prashant Nagar, Near Jagadya Chokdi, Palanpur Ugat Road, Village Palanpur Taluka Choryasi, Dist. Surat- 395 005.	Rs. 11.25 Lakh	Rs. 1.20 Lakh

Note : In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993 (as amended in the year 2016).

EMD shall be deposited by through RTGS/ NEFT in the account as per details as under :

Beneficiary Bank Name : HDFC Bank Ltd.
Beneficiary Bank Address : Sandoz House, Worli
Beneficiary Account No. : 5750000904261
IFSC Code : HDFC0000240

1) The bid increase amount will be **Rs. 10,000/-** for Lot No. 1 & 2.
2) Prospective bidders may avail online training from service provider **C1 India Pvt. Ltd. (Tel Helpline No. 7291981124/1125/1126 and Mr. Bhavik Pandya (Mobile No. 8866682937), Helpline E-mail ID : support@bankauctions.com** and for any property related queries may contact **Mr. Ashok Mehra, (Mob. No. 9898049966)**.
3) Prospective bidders are advised to visit website : <https://www.bankauctions.com> for detailed terms & conditions and procedure of sale before submitting their bids.
4) The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of hammer / close of auction and 75% within 15 days from the date of auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained.
5) The properties are being put to sale on "as is where it is", "as is what is" and "as is whatever" basis and prospective buyers are advised to carry out due diligence properly.
6) Schedule of auction is as under :-

SCHEDULE OF AUCTION

Sl No	Inspection of property	24.11.2023, Between 11.00 AM to 02.00 PM
2	Last date for receiving bids alongwith earnest money and uploading documents including proof of payment made	07.12.2023 Upto 05.00 PM
3	e-auction	08.12.2023, Between 12.00 PM to 01.00 PM (with auto extension clause of 03 minutes, till E-Auction ends)

**RECOVERY OFFICER - I
DEBTS RECOVERY TRIBUNAL - II,
AHMEDABAD**

ARDI INVESTMENT & TRADING CO. LIMITED

CIN : L65923MH1981PLC024912
Address : Hemu Castle, Shop No. 3, Dadabhai Road, Near Gokhlibai School, Vile Parle (W), Mumbai, Maharashtra-400056

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH SEPTEMBER, 2023

(Rs. in Lakhs)

Sr. No	Particulars	Quarter ended on 30-09-2023 Unaudited	Quarter ended on 30-06-2023 Unaudited	Quarter ended on 30-09-2022 Unaudited	Half Year ended on 30-09-2023 Unaudited	Half Year ended on 30-09-2022 Unaudited	Year ended on 31-03-2023 Audited
1	Total Income	16.78	10.06	-3.6	26.84	-0.38	19.37
2	Net Profit for the year before tax	-6.12	10.01	-6.28	3.89	-3.71	7.74
3	Net Profit for the year after tax	-6.12	8.01	-6.28	1.89	-3.71	5.74
4	Total Comprehensive Income for the year	-	-	-	-	-	-
5	Paid up Equity Share Capital	40.00	40.00	40.00	40.00	40.00	40.00
6	Other Equity Excluding Revaluation Reserve	-	-	-	-	-	-
7	Earnings per Share (Face Value of Rs.10/- each) Basic & Diluted	-1.53	2.00	-1.57	0.47	-0.93	1.44

Notes : (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meeting held on 02-11-2023 (2) The Company's business activity fall within a single primary business segment. (3) Previous year's figures are re-grouped, re-classified wherever necessary. For and on behalf of Ardi Investment and Trading Co. Limited Place : Mumbai || Date : 02/11/2023
sd/- **Gautam P. Sheth**, Managing Director- DIN : 06748854

INDUSIND BANK LIMITED

FRR Dept, 11th Floor, Tower 1, One Indiabulls Centre, 841, Senapati Bapat Marg, Elphinstone Road, Mumbai 400013

Possession Notice [see rule 8(1)] (For Immovable Property)

Whereas, the Authorized Officer of the IndusInd Bank Ltd, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 07-Aug-2023 calling upon the Borrower SMHRI Occupational Health Services Private Limited and the Guarantors/Mortgagor Mr. Ranjitlal Parmar, Unnati Rahulkumar Parmar and Rahulkumar Ranjitlal Parmar to repay the amount mentioned in the notice being of **Rs. 55,64,410.74 (Rupees Fifty Five Lacs Sixty Four Thousand Four Hundred Ten and Seventy Four Paise)** as on 31-07-2023 together with further interests from 01-08-2023 plus costs, charges and expenses, etc. thereon within 60 days from the date of the said notices.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 03 day of November of the year 2023.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IndusInd Bank Ltd. for an amount of **Rs. 55,64,410.74 (Rupees Fifty Five Lacs Sixty Four Thousand Four Hundred Ten and Seventy Four Paise)** as on 31-07-2023 and further interests from 01-08-2023 plus costs, charges and expenses etc. thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF PROPERTY

Property No 1: Flat no 13, 2nd floor, adm 74.35 sqmtrs, in Vishwambher Complex, situated at village Nandavel samh bearing revenue survey no. 61/1, Dist Bharuch. **East:** Flat no 14 West: Open space North: Open space South: Flat no 16 on 2nd floor. **Property No 2:** Flat no 16, 2nd Floor adm 74.35 Sqmtrs in Vishwambher Complex, situated at village Nandavel samh bearing revenue survey no. 61/1, Dist Bharuch. **East:** Flat no 15 West: Open space North: Flat no 13 on 2nd floor South: Open space

Date: 03.11.2023 **Sd/- Authorised Officer For IndusInd Bank Limited**
Place: Baruch

YUG WEAVE TECH PRIVATE LIMITED (IN LIQUIDATION)

Regd. Office.: 405, Dharti Complex, Varachha Road, Surat Surat GJ 395006 IN (CIN - U17120GJ2015PTC081783)

Notice is hereby given to the public in general in connection with sale of assets owned by Yug Weave Tech Private Limited (In Liquidation) ("Corporate Debtor"), offered by the Liquidator appointed by the Hon'ble NCLT, Ahmedabad Bench vide order dated July 06, 2022 in vide Order no. IA No. 13 of 2022 in CP (IB)74(AHM)/2020 under the Insolvency and Bankruptcy Code, 2016 ("Code").

The assets of the Corporate Debtor, forming part of its liquidation estate, are being offered for sale. The bidding shall take place through online e-auction service provider Linkstar Infosys Private Limited at <http://eauctions.co.in/>

SR. NO.	PARTICULARS	DETAILS
1	Date and Time of Auction	Date: Monday, December 04, 2023. Time: 11:00 a.m. to 4:00 p.m. (with unlimited extension of 5 minutes)
2	Address and e-mail of the Liquidator, as registered with IBBI	Reg. Address: 2nd Floor, Shree Gurudev Tower, Canada Corner, Ganpati Mandir, Near Ahirao Photo Studio, Nashik, Maharashtra - 422005 Reg. Email Id: suyashchhajer@yahoo.com
3	Process specific address for correspondence	2nd Floor, Shree Gurudev Tower, Canada Corner, Ganpati Mandir, Near Ahirao Photo Studio, Nashik, Maharashtra - 422005 E-mail id: yugweave.liquidation@gmail.com

Particulars	Reserve Price	Earnest Money Deposit	Incremental Value
*Block I: Building and other ancillary structures located on Industrial Land on Plot No. 13/A, 13/B/1, Block no.79,80,81, Limodara Industrial Estate, Limodara, Patiya, Karanj, Surat, Gujarat.	Rs. 1,13,00,000/- (Rupees One Crore Thirteen Lakhs Only)	Rs. 11,30,000/- (Rupees Eleven Lakhs Thirty Thousand Only)	Rs. 1,00,000/- (Rupees One Lakh Only)

*The Industrial Land on which the assets comprising under Block I are located is in the name of the Suspended Board of Directors of the Corporate Debtor, thus the same is being put to sale simultaneously vide e-auction conducted by Nasik Merchants Co-op. Bank Limited as per the provisions of Securitisation Reconstruction of Financial Assets.

*Please note that the assets of the Corporate Debtor falling under the category of Block I (comprising of Building) shall be sold to the same Bidder to whom the said Industrial Land of the Corporate Debtor is successfully sold vide the same e-auction platform.

Important Notes:

- The sale shall be on "AS IS WHERE IS", "AS IS WHAT IS", "WHATEVER IT IS", "WHATEVER THERE IS" and "WITHOUT RECOURSE BASIS" and as such, the sale shall be without any kind of warranties and indemnities.
- The details of the process and timelines of VDR access, site visit, due diligence etc. are outlined in the E-Auction Process Document. The said E-Auction Process Document is available on the website of e-auction service provider Linkstar Infosys Private Limited, from Saturday, November 04, 2023. Address to the said website is: <https://eauctions.co.in/>
- Interested bidders shall participate after mandatorily reading and agreeing to the relevant terms and conditions including as prescribed in E-Auction Process Document and accordingly, submit their expression of interest in the manner prescribed in E-Auction Process Document.
- The Liquidator has the absolute right to accept or reject any or all offer(s) or adjourn/postpone/cancel/modify/terminate the e-Auction or withdraw any assets thereof from the auction proceeding at any stage without assigning any reason thereof.
- As per proviso to clause (f) of section 35 of the Code, the interested bidder shall not be eligible to submit a bid if it fails to meet the eligibility criteria as set out in section 29A of the Code (as amended from time to time).

Date and Place: November 03, 2023. Nashik. **IP Suyash Chhajer** IBBI/IPA-001/IP-P02271/2020-2021/13490 **Liquidator of Yug Weave Tech Private Limited (In Liquidation)**

The Federal Bank Ltd.

LCRD/Mumbai Division, 134, 13th Floor, Jolly Maker Chambers No. 2, Nariman Point, Mumbai - 400021
E-mail : mumlcrd@federalbank.co.in
Phone : 022 - 22022548, 22028427.

1) Shri Prajapati Rameshbhai Nagarbhai @ Rameshbhai Nagarbhai Prajapati, S/o Nagarbhai Jivabhai Prajapati, 41 Yogeshwar Bunglows, Gulab Tower Road, Thal Tej, Daskroi, Ahmedabad, Gujarat, 380059,
2) Smt Prajapati Urmilaben Rameshbhai @ Urmilaben Rameshbhai Prajapati, W/o Rameshbhai Nagarbhai Prajapati, 41 Yogeshwar Bunglows, Gulab Tower Road, Thal Tej, Daskroi, Ahmedabad, Gujarat, 380059.

Notice issued under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred to as Act)

The 1st of you as principal borrower and 2nd as guarantor/co-obligant availed Federal Agri Mobile Term Loan with number 22736600000031 of ₹ 9,40,000/- (Rupees Nine Lakh Forty Thousand only) on 30.12.2016 from The Federal Bank Limited a company registered under the Companies Act having registered office at Aluva (hereinafter referred to as the bank) through its branch at Ahmedabad/ S G Highway for purchase of brand new car, after executing necessary security agreements / loan documents in favour of the Bank.

Towards the security of the aforesaid credit facility availed from the Bank, 1st of you have created security interest in favour of the Bank by way of hypothecation in respect of the following movable property.

Description of Hypothecated Movable Property

Hypothecation of Hyundai Verna FL CRDI 1.6 S, White Colour, having Chassis No. MALCU41ULGM216668, Engine No. D4FBGM092488, 2016 Model, Diesel, Registration No. GJ 01 R9 0327.

The aforesaid hypothecated security property is hereinafter referred to as "secured asset". You have defaulted repayment of the above-secured debt in violation of the agreed terms and the account became Non Performing Asset as on 14.10.2023, as per the guideline of RBI. The undersigned being Authorised Officer of the Federal Bank Ltd. hereby informs you that a sum of ₹ 3,04,801/- (Rupees Three Lakh Four Thousand Eight Hundred and One only) is due from you jointly and severally as on 18.10.2023 under your Federal Agri Mobile Term Loan with number 22736600000031 maintained with Ahmedabad/ S G Highway branch of the Bank.

As such, the Bank as a secured creditor as envisaged under section 2(zd) of the Act hereby call upon you, as contemplated under Sec.13 (2) of the said Act, to pay the said amount with further interest @ 9.90 % per annum in your Federal Agri Mobile Term Loan with monthly rests along with additional charges and cost from 30.09.2023 from you jointly and severally, till the date of payment and costs within 60 days from the date of this notice, failing which the Bank as a secured creditor shall be constrained, without prejudice to any of its other rights and remedies, to take, without any further notice, the following recourse measures prescribed under section 13(4) of the Act against you.

- To take possession of the secured assets described above and transfer the said assets by way of lease, assignment or sale for realising the dues.
- To take over the management of the secured assets and transfer them by way of lease, assignment or sale for realising the dues.
- To appoint any person to manage the secured assets the possession of which has been taken over by the bank.
- To require at any time by notice in writing, to any person who has acquired any of the secured assets from you and from whom any money is due or may become due to you, to pay to the bank.

You are also put on notice that as per section 13(13) of the Act, you shall not after receipt of this notice transfer by way of sale, lease or otherwise any of the secured assets referred to in this notice in any manner whatsoever to the prejudice of the interest of the bank without its prior written consent.

You are also put on notice that Section 13(6) of the Act empowers the bank to give a valid title to the transferee all rights in, or in relation to, the secured asset transferred as if the transfer had been made by the owner of such secured asset. Please be informed that in the event of your failure to discharge your liability in full within 60 days from the date of this notice and the bank initiates remedial actions under the provisions of the Act, you shall further be liable to pay to the bank all cost, charges and expenses incurred in that connection. Your attention is also invited to the provisions of section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets (security properties). In case the dues are not fully satisfied with the sale proceeds of the secured assets, the bank shall proceed against you for the recovery of the balance amount personally.

This notice is issued without prejudice to the other rights and remedies available to the bank for recovering its dues.

Dated this 04th day 20th of October 2023.

**Sd/-,
Authorised Officer, The Federal Bank Ltd**

Nasik Bank

(Multi-State Scheduled Bank)

The Nasik Merchants Co-operative Bank Ltd., Nashik (Multi-State Scheduled Bank)
Administrative Office : A-16, MIDC, Padmashri Babubhai Rathi Chowk, Netaji Subhashchandra Bose Marg, Satapur, Nashik- 422 007
PH: 0253-2308200 to 206 E-mail : ceo@namcobank.in Web Site : www.namcobank.in

Ref. No. HO/SAR/Auction/12/2023-2024 Date : 04/11/2023

AUCTION SALE NOTICE UNDER SARFAESI ACT 2002

(See Rule 8 of SAR/Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002)

Bids are invited from the public for purchasing the following immovable property on "AS IS WHERE IS", "AS IS WHAT IS", AND "WHAT EVER THERE IS", which is now in the possession of the Authorized Officer of The Nasik Merchants Co-op. Bank Ltd., Nashik as per Sec. 13(4) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002.

Authorized officer has decided the sale of the under mentioned property under Rule 8 and 9 of the said Act for recovery of dues under powers conferred on him under Section 13(12) and Rule 9 of the Act.

Name of the borrower & Guarantors	Description of properties	Name and address of the Branch/ Contact No.	Date of Demand Notice and Possession	Amount (Rs.) Due for Loan Recovery
Borrower :- M/s. Yug weave tech pvt. Ltd. a) 405, Dharti complex, Himmat nagar, A. K. road, Surat. b) Plot no. 13/A, 13/B1, 13/B2, Block no. 79,80,81, Bih sahayog hotel, Limodara patia, Mauje karanj, Tal. Mandvi, Dist. Surat 1) Mr. Mavani Bharatbhai Jethabhai (Director) a) 65, D.K. nagar, Bih bhagat nagar, Katargam, Surat b) Plot no.94, Sarila vihar Hsg. Soc., Opp. Tapi river, Near zoo park, Sarthana, puna surat 2) Mr. Dhanani Kantibhai Laxmanbhai (Director) a) 65, D. K. nagar, Bih bhagat nagar, Katargam, Surat b) Flat no. A-404, Devprajay residency, Singanpore road, Katargam, Surat Guarantors/consenting party :- 1) Mr. Dobanya Kantilal Muljibhai 146, Gayatri nagar, Kholwad, Kamrej, Surat 2) Mr. Findoriya Dineshbhai Govindbhai 202, Rameshwar complex, Navjivan society, Kim, Surat	A) All that Piece and Parcel of the Properties bearing block no. 79 and 81, plot no. 13/A, In area 574.93 sq.mtr. in bracket (Block no. 79 in land 400 sq.mtr. and block no. 81 in land 174.93 sq.mtr.) village karanj, Tal.Mandvi, Dist. Surat B) All that Piece and Parcel of the Properties bearing non agriculture land residential 46/1, 47/3/A and 50/2/A block no.80 in area 460 sq.mtr. survey no.44, block no.81 in area 1200 sq.mtr. plot no. 13 B and sub plot no. 13/B/1 and 13/B/2, in area 652.50 sq.mtr. and sub plot no. 13/B/1 in land area 652.50 sq.mtr. village karanj, Tal.Mandvi, Dist.Surat C) All that Piece and Parcel of the Properties bearing non agriculture land residential 46/1, 47/3/A and 50/2/A block no.80 in area 460 sq.mtr. survey no.44, block no.81 in area 1200 sq.mtr. plot no. 13 B and sub plot no. 13/B/1 and 13/B/2, in area 652.50 sq.mtr. and sub plot no. 13/B/2 in land area 1049.75 sq.mtr. village karanj, Tal.Mandvi, Dist.Surat Bounded as per record of rights.	Monday, 4th December 2023 Time - 11 am to 3 pm to 4 p.m. (With unlimited extension of 5 minutes) Place: The assets as mentioned are being offered for sale and the bidding shall take place through online e-auction service provider Linkstar Infosys Private Limited at http://eauctions.co.in/ Ph. No. 0261-2631670 9850009661 9909924924 leg@namcobank.in ceo@namcobank.in	Demand Notice Date 21/04/2016 and 28/04/2016 Symbolic Possession Notice Date 24/08/2016	ADVMAC Loan (A/c no. 17) Rs.4,08,49,932/- (Rupees Four Crore Eight lakh Forty Eight Thousand Nine Hundred Thirty Two) + further Interest thereon from Dt. 01/04/2016 + charges etc. HYP loan (A/c. no. 15) Rs. 3,59,46,662.97/- (Rupees Three Crore Fifty Nine Lakh Forty Six Thousand Six Hundred Sixty Two Rupees and Ninety Seven paise Only) + further Interest thereon from Dt. 01/04/2016 + charges etc.

Reserve Price	Earnest Money Deposit (10 % of the Reserve Price)	Incremental Amount
Rs. 1,26,00,000/- (Rupees One Crore Twenty Six Lakh only)	Rs. 12,60,000/-	Rs. 1,00,000/-

Earnest Money deposit (refundable to unsuccessful bidders) -
10% of the Offer Price by DD/PO or RTGS in favor of The Nasik Merchants Co-op. Bank Ltd., Nashik (Account No.04337080001) (IFSC Code NMC0000044) shall be submitted application along with Pan and Aadhar Card in our Surat branch. Or overdues department, Administrative Office of the Bank at Satapur, Nashik on or before Saturday, 2nd December, 2023 upto 4 p.m. No interest will be paid on EMD amount. If the DD/PO returns unpaid, such bids will be cancelled and the bidder cannot participate in auction.

Information and inspection of the Property to be sold -
The bidder can visit the property on Thursday 08, 16th November 2023 from 11 a.m. to 3 p.m. and relevant information will be made available at Administrative Office of our at our Surat Branch with prior appointment of the Authorized Officer of the bank or any working day.

KIND ATTENTION :-
Yug Weave Tech Private Limited (In Liquidation) is undergoing liquidation vide Order no: IA No. 13 of 2022 in CP (IB)74(AHM)/2020 dated July 06, 2022 passed by the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench (hereinafter referred as "Liquidation Order"). In terms of the Liquidation Order, IP CA Suyash Chhajer, Insolvency Professional having Registration Number - IBBI/IPA-001/IP-P02271/2020-2021/13490, has been appointed as the Liquidator.

Thus, the Building which is located on the Industrial land as specified above which is in the name of Yug Weave Tech Private Limited (In Liquidation), is being simultaneously put for e-auction conducted by the Liquidator as per the provisions of the Insolvency and Bankruptcy Code, 2016.

In reference to the above, please note that the assets of the Company which is mentioned above i.e. Industrial Land shall be sold to the same bidder to whom the assets comprising of Building is successfully sold vide e-auction platform conducted by the Liquidator.

Terms and Conditions :

- The Authorized Officer reserves all the rights to reject the Auction and / or adjourn/postpone the date and time of Auction or Sale Confirmation without giving any reason.
- Mortgagor/borrower/co-borrower/ guarantor may bring prospective bidders and may also remain present at the time of auction.
- The successful bidders should deposit 15% of the bid amount along with 10% amount of the Reserve price immediately and pay balance amount within 15 days from the date of Auction.
- If the successful bidder fails to pay the balance 75% of the bid amount within 15 days from date of Auction the deposited amount (EMD + 15% of bid amount) shall be forfeited and the property will be kept for sale again.
- Successful bidder will have to pay 1% TDS above the payment of Rs.50 Lakhs.
- Legal Charges for Transfer, Convenience, Stamp duty, Registration charges with Registrar, Municipal Taxes, Building maintenance, Electricity charges, Water charges as applicable if any shall be borne by purchaser and the purchaser should complete all transfer formalities which are applicable. In every case the decision of the Authorized Officer is finally binding and no complaints/clarifications will be entertained in this regards.
- The property will be sold in "AS IS WHERE IS"

ભારતીય ધનપતિઓ વધુ ઉદાર : ૩૧.૮૫૦૦ કરોડનું 'દાન' કર્યું

મુંબઈ: ભારતના ધનપતિઓ હવે તેમના પૈસીથી 'નિઃસ્વીકાર્ય-કલ્પના'ના સાચાં પ્રયોગો કરી રહ્યા છે અને તેઓ હવે વધુ 'ઉદાર' પણ બન્યા છે. ભારતના ધનપતિઓએ તેમની સંપત્તિમાંથી ૩૧.૮૫૦૦ કરોડનું દાન કર્યું છે. આ દાનમાંથી ૨૦૨૨માં ૩૧.૮૫૦૦ કરોડનું દાન કર્યું છે અને ૨૦૨૩માં ૩૧.૮૫૦૦ કરોડનું દાન કર્યું છે. આ દાનમાંથી ૨૦૨૨માં ૩૧.૮૫૦૦ કરોડનું દાન કર્યું છે અને ૨૦૨૩માં ૩૧.૮૫૦૦ કરોડનું દાન કર્યું છે.

ક્રમ	નામ	કરોડ
૧	શિવ નાડર	૩૧.૨૦૪૨
૨	અમીત પ્રેમજી	૩૧.૧૭૭૪
૩	મુકેશ અંબાણી	૩૧.૦૭૬૬
૪	કુમાર મંગલમ નિરલા	૩૧.૦૬૬૬
૫	ગોવિંદ અમ્બાણી	૩૧.૦૬૬૬
૬	અનિલ અમ્બાણી	૩૧.૦૬૬૬
૭	નંદન નિલકાણી	૩૧.૦૬૬૬
૮	સાવરસ પુનાવાલા	૩૧.૦૬૬૬
૯	રોહિણી નિલકાણી	૩૧.૦૬૬૬
૧૦	રોહિણી નિલકાણી	૩૧.૦૬૬૬

ગત વર્ષની સરખામણીમાં ૫૯% વધુ પ્રથમ ક્રમે એચસીએલના શિવ નાડર, ટોપ ૧૦ની યાદીમાં ઈન્ફોસીસના સહસ્થાપક નંદન અને રોહિણી નિલકાણીના નામ: મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પણ 'સહાયત' કરે છે

યર્ષામાં છે. તે ગૌતમ અદાણી એ ૩૧.૨૦૪૨ કરોડનું દાન કર્યું છે અને અગાઉના વર્ષની સરખામણીમાં ૫૦% વધુ હતું તો તેમનાથી ૫૯ વધુ ધનવાન અને દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ૩૧.૦૭૬૬ કરોડનું દાન કર્યું છે. ભારતની સાત મહિલાઓ પણ આ યાદીમાં છે. જેમાં પ્રથમ ક્રમે ઈન્ફોસીસના સહસ્થાપક નંદન નિલકાણીના પત્ની રોહિણી નિલકાણી છે જેણે ૩૧.૦૬૬૬ કરોડનું દાન કર્યું છે. તો પછી સુભાષિણી અંબાણી અને રોહિણી નિલકાણી છે જેણે ૩૧.૦૬૬૬ કરોડનું દાન કર્યું છે. તેઓ સૌથી નાની ઉંમરના ધનપતિઓ છે. જેઓ ૨૦૨૨માં ૩૧.૦૬૬૬ કરોડનું દાન કર્યું છે.



કર્ણાટકમાં મચ્છરોમાં ઘાતક ઝીકા વાયરસ મળી આવતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ ચિકિત્સકોએ (કર્ણાટક) તા. ૩ જિલ્લામાં મચ્છરોમાં ઘાતક ઝીકા વાયરસ હોવાનું બહાર આવતા કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ પર છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના ૬૮ અલગ અલગ સ્થળો પર મચ્છરોના શરીરમાં ઝીકા વાયરસની હાજરીનો ટેસ્ટ કરાયો હતો. આ જ રીતે ચિકિત્સકોએ જિલ્લાના ૬ સ્થળોએથી સેમ્પલ લેવામાં આવેલ. ઝીકા વાયરસ સિદ્ધલાવઢા તાલુકાના તાલાકાયાલાબેટ્ટા ગામના મચ્છરોમાં મળી આવ્યા હતા. જેને લઈને સ્વાસ્થ્ય અધિકારીઓ તરત જ કાર્યવાહીમાં લાગી ગયા અને વાયરસના ફેલાવાને રોકવા માટે નિવારક ઉપાય શરૂ કરી દીધા. સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી પહેલા જ પાસ બેંકનો અધિકારી યોગેશ શર્મા છે. અધિકારીઓએ ૩૦ ગર્ભવતી મહિલાઓ અને તાલુકાના લગભગ ૭૦ વ્યક્તિઓના બ્લડના સેમ્પલો એકત્ર કરાયા છે તેને પરીક્ષણ માટે બેંકુર મોકલાયા છે.

વિશ્વની મધ્યસ્થ બેંકોએ નવ માસમાં ૮૦૦ ટન સોનું ખરીદ્યું

મુંબઈ તા. ૩ છેલ્લા એક વર્ષ કે વધુ સમયથી ચાલી રહેલા યુકેન અને રશિયાના યુદ્ધ તેમજ હાલમાં ઈઝરાયેલ તથા હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે વિશ્વભરમાં સલામતીની ચિંતા જાગી છે અને પાસ કરીને આર્થિક સલામતી માટે દુનિયાભરની મધ્યસ્થ બેંકો હવે સોનું ખરીદવા લાગી છે. જેમાં ચીન, સિંગાપોર અને પોલેન્ડ એ સૌથી મોટા ખરીદદાર બન્યા છે. ધ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે જાન્યુઆરી સપ્ટેમ્બર સુધીમાં અનેક દેશોની કેન્દ્રીય બેંકોએ કુલ ૮૦૦ ટન સોનું ખરીદ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો જો ઉંચા ફાગવાનો સામનો કરી રહ્યા છે તે ઉપરાંત ઇથોપીયાની અનિશ્ચિતતાઓ પણ વધી છે તેના કારણે હવે મધ્યસ્થ બેંકો પણ તેના રિઝર્વમાં સોનાનો ઉમેરો કરી રહી છે. ચીને તેના ગોલ્ડ રિઝર્વમાં ૧૮૧

S. No.	Gold Loan Account	BRANCH	Name Of the Borrower	Liability
1	41005632316	Drive In Road Branch	CHUNILAL AMRITLAL KALAL	110714.00

વારાણસીમાં આંતરરાષ્ટ્રીય યુનિકોર્મ-ગારમેન્ટ પ્રદર્શન

વર્લ્ડ યુનિકોર્મ બજાર ૨૦૩૦માં ૨૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા

વારાણસી, તા. ૩ આવ્યા છે. ૨૦૨૦માં વર્લ્ડ યુનિકોર્મ ઉદ્યોગમાં યુનિકોર્મ બજાર ૬.૨ અબજ ડોલર થયેલ અને મહારાષ્ટ્રમાં સોલાપુર તેનું કેન્દ્ર બને તેવાં વડા અબજ ડોલરે પહોંચી અને પ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાને ૨૦૩૦માં તે ૨૫ અબજ ડોલરે સાકાર કરવા માટે ૬-૧૮ ડિસેમ્બરે પહોંચવાની સંભાવના ધરાવતા વારાણસીમાં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ૧૦,૦૦૦થી વધુ યુનિકોર્મની ડિઝાઇન અને ૨૦,૦૦૦થી વધુ યુનિકોર્મ ફેબ્રિકેશની ડિઝાઇન સાથે ૨૦૦ અગ્રણી બ્રાન્ડ્સ આકર્ષક એવું લક્ષ્ય છે. એસએમએ દ્વારા આ ઊંચું યુનિકોર્મ પ્રદર્શન છે, જે ૧૬-૧૮ ડિસેમ્બરે વારાણસીના શ્રી કાશી વારાણસી દિનદયાલ હેન્ડિક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં યોજાશે. એસએમએના સતીશ પવારને પ્રદર્શનના અધ્યક્ષ અને પ્રકાશ સંગમ, પવારને સચિવ તરીકે નીમવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ૧૦,૦૦૦થી વધુ યુનિકોર્મની ડિઝાઇન અને ૨૦,૦૦૦થી વધુ યુનિકોર્મ ફેબ્રિકેશની ડિઝાઇન સાથે ૨૦૦ અગ્રણી બ્રાન્ડ્સ આકર્ષક એવું લક્ષ્ય છે. એસએમએ દ્વારા આ ઊંચું યુનિકોર્મ પ્રદર્શન છે, જે ૧૬-૧૮ ડિસેમ્બરે વારાણસીના શ્રી કાશી વારાણસી દિનદયાલ હેન્ડિક્રાફ્ટ કોમ્પ્લેક્સમાં યોજાશે. એસએમએના સતીશ પવારને પ્રદર્શનના અધ્યક્ષ અને પ્રકાશ સંગમ, પવારને સચિવ તરીકે નીમવામાં આવ્યું છે.

S. No.	Gold Loan Account	BRANCH	Name Of the Borrower	Liability
1	41005632316	Drive In Road Branch	CHUNILAL AMRITLAL KALAL	110714.00

Sr. No.	Particulars	Quarter ended on 30-09-2023 Unaudited	Quarter ended on 30-06-2023 Unaudited	Quarter ended on 30-03-2023 Unaudited	Half Year ended on 30-09-2023 Unaudited	Half Year ended on 30-03-2023 Unaudited	Year ended on 31-03-2023 Audited
1	Total Income	16.78	10.06	-3.6	26.84	-0.38	19.37
2	Net Profit for the year before tax	-6.12	10.01	-6.28	3.89	-3.71	7.74
3	Net Profit for the year after tax	-6.12	8.01	-6.28	1.89	-3.71	5.74
4	Total Comprehensive Income for the year	-	-	-	-	-	-
5	Paid up Equity Share Capital	40.00	40.00	40.00	40.00	40.00	40.00
6	Other Equity Excluding Revaluation Reserve	-	-	-	-	-	-
7	Earnings per Share (Face Value of Rs.10/- each) Basic & Diluted	-1.53	2.00	-1.57	0.47	-0.93	1.44

Sr. No.	Particulars	Quarter Ended 30.09.2023 Unaudited	Half Year Ended 30.09.2023 Unaudited	Quarter Ended 30.09.2022 Unaudited
1	Total Income from Operations (net)	11,098.22	21,790.72	6,848.33
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,793.64	7,587.83	1,417.31
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,793.64	7,689.33	1,417.31
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,952.33	6,053.99	860.22
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,111.14	6,229.10	1,655.27
6	Equity Share Capital (Face Value of ₹. 10/- Per Share)	3,200.00	3,200.00	3,200.00
7	Other Equity	-	-	-
8	Earning per share of ₹. 10/- each (from Continuing and Discontinuing Operations)	-	-	-
9	Basic (in ₹.)	4.61	9.46	1.34
10	Diluted (in ₹.)	4.61	9.46	1.34

iPhone-17નું ઉત્પાદન ચીનમાં નહીં પણ ભારતમાં થશે

આઈફોનના ઉત્પાદનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર Apple હવે ભારતમાં iPhone-17નું ઉત્પાદન કરશે. આ પહેલીવાર હશે જ્યારે Appleની મેચુફેક્ચરિંગ કંપની નવા iPhoneનું ઉત્પાદન ચીનની બહાર અન્ય કોઈ દેશમાં કરશે. એપલ-સંબંધિત વિશ્લેષક મિંગ ચી કાઉંએ દાવો કર્યો છે કે ભારતમાં આઈફોનનું ઉત્પાદન પણ વધશે અને આઈફોનના ઉત્પાદનનો હિસ્સો ૨૦ થી ૨૫ ટકા હોઈ શકે છે. iPhone 17નું પ્રોડક્શન વર્ષ ૨૦૨૪ના પીઠ ભાગમાં શરૂ થઈ શકે છે. મિંગે પોતાના બ્લોગમાં જણાવ્યું કે કંપની ૨૦૨૫માં લોન્ચ થવાના iPhone 17નું ઉત્પાદન ૨૦૨૪માં જ શરૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનને ૨૦૨૫માં દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવશે. ટાટાએ વિસ્ફોટ કર્યું હતું એક્વિઝિશન: તમને જણાવી દઈએ કે એપલ આઈફોન ભારતમાં એસએમએ થાય છે, એટલે કે આઈફોન તમામ પાર્ટ્સ એસએમએ કરીને બનાવવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે આઈફોન-17 મોડલ ચીનની બહાર ભારતમાં બનાવવામાં આવશે.

Sr. No.	Particulars	Quarter Ended 30.09.2023 Unaudited	Half Year Ended 30.09.2023 Unaudited	Quarter Ended 30.09.2022 Unaudited
1	Total Income from Operations (net)	11,098.22	21,790.72	6,848.33
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,793.64	7,587.83	1,417.31
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,793.64	7,689.33	1,417.31
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,952.33	6,053.99	860.22
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,111.14	6,229.10	1,655.27
6	Equity Share Capital (Face Value of ₹. 10/- Per Share)	3,200.00	3,200.00	3,200.00
7	Other Equity	-	-	-
8	Earning per share of ₹. 10/- each (from Continuing and Discontinuing Operations)	-	-	-
9	Basic (in ₹.)	4.61	9.46	1.34
10	Diluted (in ₹.)	4.61	9.46	1.34

Particulars	Current Quarter Ending 30-Sep-23	Year to Date 30-Sep-23	Corresponding 3 months ended in the previous year 30-Sep-22
Total Income from Operations	5614.83	11521.88	683.95
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	89.28	13.14	(420.19)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	89.28	13.14	(420.19)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	75.68	(10.28)	(507.71)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	77.52	(10.27)	(505.80)
Equity Share Capital	387.50	387.50	387.50
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous Year	-	-	-
Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued operations)	0.20	(0.02)	(1.31)
1) Basic :	0.20	(0.02)	(1.31)
2) Diluted :	0.20	(0.02)	(1.31)

Sr. No.	Particulars	Quarter Ended 30.09.2023 Unaudited	Half Year Ended 30.09.2023 Unaudited	Quarter Ended 30.09.2022 Unaudited
1	Total Income from Operations (net)	9,577.93	19,031.66	7,030.74
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,205.09	6,360.04	2,276.46
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	2,398.43	4,759.35	1,721.40